

ચોકબજાર પોલીસ સ્ટેશન સુરત શહેર.

ચોકબજાર પો.સ્ટે. । ગુ.ર.નં.૧૭૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામે અગાસી ઉપર મરણ જનાર એક અજાણ્યા પુરૂષ ઇસમ ઉ.વ આશરે ૩૦ થી ૩૫ નાને કોઇ અજાણ્યા ઇસમે કોઇ પણ કારણસર કોઇ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઇજા કરી તથા જમણી આંખની ઉપર કપાળમાં ઇજા કરી અથવા ગળે ટુપો આપી મોત નીપજાવી નાસી જઇ ગુનો કરેલ જે ગુનાની તપાસ દરમ્યાન મરણ જનાર અજાણ્યા ઇસમની લાશના ફોટા પંડોળ વિસ્તારમાં બતાવી મરણ જનાર વિક્રમસિંહ ઓમપ્રકાશ રહે, પંડોળ પોલીસ ચોકીની આગળ કલ્પેશની બીલ્ડીગામા ત્રીજા માળે રૂમમાં ચોકબજાર સુરતનો હોવાનું જણાઇ આવેલ હોય અને મરણ જનાર પંડોળ સહયોગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નંબર બી/૫૯ ની બાજુમાં આવેલ યાની દુકાન ઉપર અવાર નવાર યા પીવા જતો હોય યાની દુકાન ભોલા ડ/૦ કલ્લુ સરોજ (પાસી) નાનો ચલાવતો હોય જેને આજરોજ પકડી પાડી તેની પુછ પરછ કરતા મરણ જનાર વિક્રમસિંહ ઓમપ્રકાશ નાઓ પોતાની પાસેથી તથા પોતાના મિત્ર રેજાઉલ ઉર્ફે બંગાળી હનીફ ગાજીનાઓ પાસેથી અવાર નવાર આવી પૈસા લઇ જતો હતો અને પોતે પૈસા ન આપે તો તેઓ બંને સાથે ઝગડો તકરાર કરતો હોય જેથી પોતે તથા પોતાના મિત્ર આરોપી રેજાઉલ ઉર્ફે બંગાળી હનીફ ગાજી રહે, ૧૩૫, પંડોળ સહયોગ પાવરલુમ્સ સોસાયટી, રૂસીત મહેન્દ્રભાઇ માંગુકીયાના ખાતામાં ચોકબજાર, સુરત. મુળ. આલીપુરગામ, થાના જયનગર મોજીલપુર જી, ડોખીન ચોવીસ પરગાના વેસ્ટબંગાળ નાઓએ સાથે મળીને તારીખ ૧૦/૦૮/૨૦૧૮ ના રોજ કલાક ૨૩/૦૦ વાગેના પોતાની યાની દુકાન નંબર ૧૦ માં વિક્રમસિંહ ઓમપ્રકાશસિંહ નાઓને આરોપી ભોલા કલ્લુ સરોજ નાઓએ લાકડાના ફટકાથી જમણી આંખની ઉપર કપાળના ભાગે મારી ઇજા કરી તથા આરોપી રેજાઉલ ઉર્ફે બંગાળી હનીફ ગાજીનાઓએ ગળાના ભાગે ચપ્પુ ફેરવી મોત નીપજાવી વિક્રમસિંહના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપીયા ૪,૦૦૦/- કાઢી લઇ તેની લાશને સગેવગે કરવા સારૂ બંને જણા લાશ ઉચકીને પ્લોટ નંબર બી/૫૯, ની અગાસી ઉપર લઇ જઇ અગાસી ઉપર પડેલ રેતીના ઢગલામાં દાટી દીધેલ હોવાની કબુલાત કરતા આરોપી ભોલા ડ/૦ કલ્લુ સરોજ (પાસી) ઉ.વ ૩૭ રહે. પ્લોટ નંબર ૧૦૭ દુકાન નંબર ૧૦ માં પંડોળ સહયોગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ચોકબજાર સુરતનાઓને તારીખ ૧૫/૦૮/૨૦૧૮ ના કલાક ૧૬/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે અને મરનાર વિક્રમસિંહ ઓમપ્રકાશસિંહ નાઓના સગા સંબંધીઓની તેઓના વતન ખાતે તપાસ કરવા તજવીજ હાથ ધરેલ છે.